

Google Meet video calls to now adapt to internet speed at home

New Delhi, Google has released new Chrome OS updates that will help students run video calls at home while they're using apps like Google Classroom, Docs, Sheets, Slides and other tools, regardless of the device or the strength of their internet connections.

The update will help students as they're using the same networks as their parents, guardians and siblings, putting heavy demand on bandwidth.

Google Meet will now adapt to the speed of your network by temporarily turning off some video feeds, to make sure you're not interrupted if many people are using your connection at the same time.

"Making sure devices can handle video confer-

ences all day while running various apps and software that require a lot of power is incredibly important. That's why we've been focused on improving Chromebooks," Google said in a statement on Thursday.

In Chrome OS, Google has improved how Meet videos are streamed.

The improvements will make it easier for educators and students to choose a feature like grid view, where they can see images of other Meet attendees without affecting the performance of other apps.

"So if students are taking notes in a Google Doc while in a Meet, or running a Kahoot! game at the same time, they'll be able to see everyone," Google said.

The company has also improved Chromebooks'

camera and video feed performance and efficiency by making sure that audio and video data don't require any unnecessary processing.

"We're working on making Google Meet adapt more intelligently to your device, your network and what you're working on". Educators and learners who use Zoom will also see performance improvements during their videoconferences.

Google and Zoom engineering teams have been working together on service enhancements for Chrome devices.

"Just like Meet, Zoom will adjust video performance based on devices in use and what participants are using their devices to do," Google said.

—IANS

Das urges policy action to keep petro products, industrial raw material prices under check

Mumbai, Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das on Friday put onus on both the Centre and states to ensure through concerted policy measures that current cost build in petroleum products and industrial raw materials does not escalate further.

Without directly seeking a cut in excise and VAT levies, the RBI Governor said that petroleum product prices have reached historic highs as international crude prices surged in recent months and "the high indirect taxes remain", both in the Centre and states.

Petrol and fiscal prices in the country has reached historic high levels. Apart from global movement in crude prices, high indirect taxes on the two products have contributed to its retail prices

getting elevated.

In a video statement after the Monetary Policy Committee's bi-monthly meet, Das said the spike in petro product prices, along with the sharp increase in industrial raw material prices have resulted in a broad-based increase in prices of services and manufacturing products in recent months.

This if not checked through policy action by governments, Das indicated could have a bearing on inflation that has showed signs of easing.

The RBI had build the recent cost pressure coming into various sectors while giving its outlook on inflation. It has revised CPI inflation projection to 5.2 per cent for Q4:2020-21, 5.2 per cent to 5.0 per cent in H1:2021-22 and 4.3 per cent

for Q3:2021-22, with risks broadly balanced.

After breaching the upper tolerance threshold continuously since June 2020, CPI inflation moved below 6 per cent in December 2020 for the first time in the post-lockdown period, supported by favourable base effects and a sharp fall in key vegetable prices, the latter accounting for around 90 per cent of the decline in headline inflation during November and December 2020.

Both higher fresh arrivals and active supply side interventions contributed to this favourable development, Das said.

It is expected that vegetable prices will remain soft in the near-term, while pressures may continue to persist in certain key food items, he said.

Business Brief

RBI gives retail investors direct access to G-sec market

Mumbai, The Reserve Bank of India (RBI) has decided to give retail investors direct access to the government securities market. The major structural reform was announced by RBI Governor Shaktikanta Das on Friday. According to Das, India will join a select group of countries offering such facility to investors.

The new arrangement, Retail Direct, will allow direct access to retail investors via the RBI. This will allow such investors to open Gilt account with the apex bank.

Banking stocks power bull run, Nifty50 crosses 15k pts mark

Mumbai, A massive surge in Banking stocks lifted India's equity indices during the morning trade session on Friday with the NSE Nifty50 crossing the 15,000 points mark. Amongst sectoral indices, interest rate sensitive stocks such as banking, auto and capital goods rose before the announcement of the final monetary policy review of 2020-21. Consequently, the NSE Nifty50 crosses the 15,000 points mark during the session, but receded afterwards. At 9.50 a.m., the S&P BSE Sensex traded at 50,895.58, higher by 281.29 points or 0.56 per cent from its previous close of 50,255.75. The Nifty50 traded at 14,960.80, higher by 65.15 points or 0.44 per cent from its previous close.

FY22 GDP growth seen at 10.5%: RBI Gover

Mumbai, After an estimated contraction in the current financial year, India's GDP is expected to grow at 10.5 per cent in FY2021-22, said RBI Governor Shaktikanta Das on Friday. In a video statement after the Monetary Policy Committee's bi-monthly meet, Das said that growth in the first half of FY22 is projected to be in the range of 8.3-26.2 per cent and 6 per cent in the third quarter. The robust growth projection for the coming fiscal comes on the back of the low base in the current financial year, which has been largely hit by the pandemic and the eventual lockdowns. He said that growth outlook has improved significantly with positive impulses becoming more broad-based, adding that 2021 is setting stage for new economic era. On inflation, Das said that the central bank's near-term outlook for inflation in the country is stable.

NASA awards Firefly Aerospace \$93.3M to deliver payloads to Moon

Washington, NASA has awarded Texas-based Firefly Aerospace approximately \$93.3 million to deliver a suite of 10 science investigations and technology demonstrations to the Moon in 2023.

The delivery, planned for Mare Crisium, a low-lying basin on the Moon's near side, will investigate a variety of lunar surface condi-

tions and resources, NASA said on Thursday, adding that such investigations will help prepare for human missions to the lunar surface.

The award is part of NASA's Commercial Lunar Payload Services (CLPS) initiative, in which the agency is securing the service of commercial partners to quickly land science and technology payloads on the lunar surface.

The initiative is a key part of NASA's Artemis program. Firefly Aerospace will be responsible for end-to-end delivery services, including payload integration, launch from Earth, landing on the Moon, and mission operations.

PayPal to stop India payment services from April 1

New Delhi, Global digital payment platform PayPal on Friday decided to wind down its domestic payment services in India from April 1. From April 1, the company will focus all its attention on enabling more international sales for Indian businesses, and shift focus away from its domestic products in India.

"This means we will no longer offer domestic payment services within India from April 1," a PayPal spokesperson told IANS.

The company has three centres in Bengaluru, Chennai and Hyderabad which are touted as the largest outside the US.

The company also has its business development

teams in India.

PayPal said that it will continue to invest in product development that "enables Indian businesses to reach nearly 350 million PayPal consumers worldwide, increase their sales internationally, and help the Indian economy return to growth". The company processed \$1.4 billion worth of international sales for over 360,000 merchants in India last year. The company on Thursday reported a strong growth in the fourth quarter of 2020 with revenue of \$6.12 billion.

It reported total payment volume (TPV) of \$277 billion, growing 39 per cent. It added 16 million Net New Active Accounts (NNAs) in the fourth quarter.

ARCHIT ORGANOSYS LIMITED
Regd. Off.: Plot No. 25/9-A, Phase-III, GIDC Naroda, Ahmedabad-382330. Ph: 079-26873340
E-Mail: share@architorg.com Website: www.architorg.com CIN: L24110G1993PLC019941

NOTICE
NOTICE is hereby given that pursuant to the provisions of Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 the meeting of Board of Directors of the Company will be held on Saturday, February 13, 2021 to consider and approve the un-Audited Financial Result of the Company for the quarter and nine months ended on 31st December, 2020 along with any other business (if any).
This information is available on the website of the Company i.e. www.architorg.com and on website of BSE Ltd. i.e. www.bseindia.com.
For Archit Organosys Limited
Date : 05.02.2021
Place : Ahmedabad
Chairman & Whole Time Director (DIN: 00038972)

TIRUPATI SARJAN LIMITED
Regd. Office: A-11, 12, 13, Satyamev Complex, Opposite Gujarat High Court, S.G. Highway, Ahmedabad - 380060, Website: www.tirupatisarjan.com
CIN: L45100GJ1995PLC024091

NOTICE
Notice is hereby given, that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, meeting of Board of Directors of the Company is scheduled to be held on Saturday, 13th February, 2021, at Registered office of the Company inter alia to consider and approve the Unaudited Financial Results of the Company for the quarter ended 31st December, 2020.
The details of aforesaid meeting shall also be on the website of the Company i.e. www.tirupatisarjan.com and also on the website of the Stock Exchange i.e. www.bseindia.com.
For, Tirupati Sarjan Limited,
Sd/-
Ruchir Rushikeshbhai Patel,
Director (DIN-03185133)

CHANGE OF NAME
I have changed my name from **MANJUKUMARI MADANLAL GHIYA** to new name **MANJUDEVI MADANLAL GHIYA**
Add.: 204, Shree Shankheshwar Appt, Shahibaug, Ahmedabad
3189

WESTERN RAILWAY
MISCELLANEOUS ENGINEERING WORKS IN UDHNA-JALGAON SECTION
Divisional Railway Manager (WA), Western Railway, Mumbai Central, Mumbai-400008 invites e-Tenders as per details given as follows:

Sr. No.	Executive	Tender Notice No. & Date	Work and Location	Approx. cost of work (₹)
1.	DEN(E) BCT	BCT/20-21/337, dtd. 05.02.2021	Udhna-Jalgaon section : TBR plain track, P&C, TFTR, CTR, CRR and TTR under ADEN-Nandurbar jurisdiction in connection of sanctioned track works for year 2020-21	15,72,63,096.14
2.	DEN(E) BCT	BCT/20-21/338, dtd. 05.02.2021	Udhna-Jalgaon section : TBR plain track, P&C, Shoulder & Crib ballast, TFTR, TRR, CRR and TTR under ADEN/Amalner in connection of sanctioned track works for the year 2020-21.	12,32,62,798.93

EMD : For both SI. Nos. - ₹ 0.00/- . **Date & Time of submission :** For both SI. Nos.- On 16.03.2021 at 15.00 hrs. **Date & Time of opening :** For both SI. Nos.- On 16.03.2021 at 15.30 hrs. Regarding detailed nature of work, containing cost of tender document (non-refundable), EMD, eligibility criteria, similar nature of work, detailed tender conditions, Please visit website www.ireps.gov.in Manual offers will not be considered. 0639

Like us on : [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) | Follow us on : twitter.com/WesternRly

BISIL PLAST LIMITED
[CIN: L17119GJ1986PLC009009]
Registered Office: 406, Silver Oaks Commercial Complex, Opp. Arun Society, Paldi, Ahmedabad 380 007

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020
(Rs. In lakh)

Particulars	Quarter ended on 31-12-2020 (Unaudited)	9 Months ended on 31-12-2020 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2019 (Unaudited)
Total income from operations (Net)	32.05	86.31	25.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Total Comprehensive Income for the period	0.01	(2.25)	(0.19)
Equity Share Capital	540.31	540.31	540.31
Earnings Per Share (after extraordinary items) (Face value of Re. 1/- each) (for continuing and discontinued operations)	-	-	-

NOTE.
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Quarterly Financial Results is available on the website of BSE Limited at www.bseindia.com.

For BISIL PLAST LIMITED
Date : 5th February, 2021
Place : Ahmedabad
SANJAY S. SHAH
MANAGING DIRECTOR (DIN:01515296)

SAKAR HEALTHCARE LIMITED
[CIN: L24231GJ2004PLC043861]
Reg. Office: Block No.10-13, Village: Changodar, Sarkhej-Bavla Highway, Tal: Sanand, Dist: Ahmedabad - 382 213
Phone: 02717-250477 Fax: 02717-251621 Email: info@sakarhealthcare.com Web: www.sakarhealthcare.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020
(Rs. In Lakh)

PARTICULARS	Standalone			Consolidated	
	Quarter ended on 31-12-2020 (Unaudited)	Nine Months ended on 31-12-2020 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2019 (Unaudited)	Quarter ended on 31-12-2020 (Unaudited)	Nine Months ended on 31-12-2020 (Cumulative) (Unaudited)
Total income from operations (Net)	2679.34	7305.79	2226.38	2,679.34	7305.79
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	224.96	1100.60	292.15	224.96	1100.45
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	224.96	1100.60	292.15	224.96	1100.45
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	179.95	894.80	220.96	179.95	894.66
Total Comprehensive Income for the period	178.90	891.64	220.96	178.90	891.50
Equity Share Capital	1469.10	1496.10	1496.10	1496.10	1496.10
Earnings Per Share (Face value of Rs. 10/- each) (after extraordinary items) (for continuing and discontinued operations)					
Basic	1.20	5.96	1.48	1.20	5.96
Diluted:	1.20	5.96	1.48	1.20	5.96

NOTES:
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results (Standalone & Consolidated) filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Quarterly Financial Results (Standalone & Consolidated) are available on the website of National Stock Exchange of India Limited at www.nseindia.com

Date : 5th February, 2021
Place : Ahmedabad

For SAKAR HEALTHCARE LIMITED
Sd/- SANJAY S. SHAH
MANAGING DIRECTOR (DIN : 01515296)

SHREE NARMADA ALUMINIUM INDUSTRIES LIMITED
(CIN: L9110GJ1981PLC004269)
REGISTERED ADDRESS: PLOT NO 95/1, BHOLAV PALAJ ROAD, BHALAV BHARUCH 392001
Email ID: nalexhb@yahoo.co.in Website: www.snailbh.in

NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015 and other applicable provisions / rules and regulations, this is to inform you that, a meeting of the Board of Directors of the Company is scheduled to be held, on Saturday, 13th February 2021, at 2.30 P.M at 69, Princess Street, Mumbai 40002 inter-alia to consider and approve Unaudited Financial Results of the Company for the quarter end December 31, 2020 and to take on record Limited review report thereon. Further Details are available at the website of the company at www.snailbh.in and also at the website of BSE Ltd at www.bseindia.com. Further Details are available at the website of the company www.snailbh.in and also at the website of BSE Ltd at www.bseindia.com.

For SHREE NARMADA ALUMINIUM INDUSTRIES LTD.
Place : Bharuch
Date : 06.02.2021
Kantilal Patel, Managing Director

AKASH INFRA-PROJECTS LIMITED
CIN: L45209GJ1999PLC036003
Registered Office: 2 Ground Floor, Abhishek Complex, Opp. Hotel Havelli, Sector-11, Gandhinagar -382011 Ph. : 079-23227006
E-mail:- info@akashinfra.com Website:- www.akashinfra.com

NOTICE
NOTICE is hereby given that pursuant to the provisions of Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 a meeting of Board of Directors of the Company is scheduled to be held on Saturday, 13th February, 2021 at the Registered Office of the Company to consider and approve the Unaudited Standalone and Consolidated Financial results of the Company for the quarter and nine months ended on 31st December, 2020 along with any other business (if any).
This information is available on the website of the Company i.e. www.akashinfra.com and website of NSE Limited i.e. www.nseindia.com.

For Akash Infra-Projects Limited
Yoginkumar Patel
Managing Director
DIN: 00463335

Dated : 5th February, 2021
Place : Gandhinagar

CHANGE OF NAME
I have changed my name from **HANDA RENUKA KEVALKRISHNA** to new name **HANDA RENU KEVALKISHAN**
Add.: M-202, Safal Parisar-2, South Bopal, Ahmedabad-380058
3188

CHANGE OF NAME
I have changed my name from **TARAK SHANKARBHAI UPADHYAY** to new name **TARAKKUMAR SHANKARBHAI UPADHYAY**
Add.: C-48, Cozy Corner Someshwar Park-3, Ghatlodia, Ahmedabad
3190

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION
VARIOUS ELECTRICAL WORKS
E-Tender Notice No. Sr.DEE/ADI/39 (20-21), dtd. 01-02-2021, Tender No. EL-50-1-ADI-T-58-2020-21 (1) Name of Work: Ahmedabad Division: Electric work in connection with Augmentation, Up gradation, modification of power supply installations, SCADA and other works. (2) Estimated cost: ₹ 1,89,25,157/- (3) EMD: NIL (4) Date and Time of Submission and opening: Not later than 15:00 Hrs of 02-03-2021 and 02-03-2021 at 15:30 Hrs. (5) Address of the office and Website details: Sr. Divisional Electrical Engineer, D.R.M. Office (W.R.), Nr. Chumunda Bridge, Opp. G.C.S. Hospital, Naroda Road, Andpura, Ahmedabad-382345. Website: www.ireps.gov.in
ADI-209
Follow us on : [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) | twitter.com/WesternRly

CHANGE OF NAME
I have changed my name from **DIXITKUMAR SHAH** to new name **DIXIT ASHOK SHAH**
Add.:16 Hindu Colony, Opp. Sardar Patel Stadium, Navrangpura, Ahmedabad-383009
V045

CHANGE OF NAME
I have changed my name from **NAIMESH NITISHKUMAR JANI** to new name **NAIMESHKUMAR NITISHKUMAR JANI**
Add.: 25, Shreejainagar-2, Ranip, Ahmedabad
3187

STATE EXAMINATION BOARD, GANDHINAGAR
Rashtriya Indian Military College (RIMC) Entranced Exam JUN-2021 (Term Jan 2022)
GOVERNMENT OF INDIA
Rashtriya Indian Military College (RIMC) Entrance Exam JUN-2021 (Term Jan 2022) will be taken by State Examination Board, Gandhinagar on Date : **05 JUN 2021** in Gandhinagar.
Education Qualification - Boys Candidates should either be studying in **Class VII** or passed **Class VII** from any recognized school at the time of admission to the RIMC, i.e. on **01 JAN 2022**.
Entry Age - Boys Candidates appearing for the above test should not be less than 11^{1/2}, 2% years in age but should not have attained the age of 13 years as on **01 Jan 2021**, i.e., they should be born not earlier than **01 Jan 2009** and not later than **01 Jul 2010**.
Procedure to Obtain Application Forms - (A) The prospectus-cum-application form and booklet of old question paper can be obtained from "The Rashtriya Indian Military College, Garhi Cantt, Dehradun, Uttarakhand, Pn-248003" through Speed post by forwarding self addressed slip and an account payee bank demand draft of **Rs 600/- for General Candidates and Rs 555/- for SC/ST candidates** along with cast certificate. The demand draft will be made in favour of the **COMMANDANT RIMC DEHRADUN, DRAWEE BRANCH, STATE BANK OF INDIA, TEL BHAVAN, DEHRADUN, (BANK CODE-01576), UTTARAKHAND**. The address should be TYPED/WRITTEN CLEARLY IN CAPITAL LETTERS with pin code and contact number.
Or
(B) On-line Payment The prospectus-cum-application form and booklet of old question papers can also be obtained by making on-line payment of Rs 600/- for General Candidates & Rs.555/- for SC/ST candidates on RIMC website www.rimc.gov.in. On receipt of the payment the prospectus-cum-application form and booklet of old question papers will be dispatched by Speed post only.
Application in duplicate on prescribed form accompanied by document to be attached with application form two passport size photographs, Domicile Certificate of the Candidate, Birth certificate (Issued by Municipal Corporation/Gram Panchayat), SC, ST Certificate and Certificate from principal of the school in original with photograph on it attested stating date of birth and in which Class Studying. Application Form should reach at **Secretary, State Examination Board, Opp. Government Library, Sector-21, Gandhinagar** on or before **15 April 2021**.
NOTE. Locally Printed / Photocopy and without RIMC Hologram forms will be rejected. For more Info. Website: www.rimc.org and www.sebexam.org

Date :- 05.02.2021 INF/1913/20-21
Secretary, State Examination Board, Gandhinagar

GOVERNMENT OF INDIA, DEPARTMENT OF SPACE, SPACE APPLICATIONS CENTRE (SAC), CONSTRUCTION & MAINTENANCE GROUP (CMG), JODHPUR TEKRA, AMBAWADI VISTAR P.O., AHMEDABAD -380015 Ph. No: 079) 28914960 / 4927 / 4901, FAX No: 079) 28915800

E-Tender Notice (NT) No : (I) SAC/CMG/CPHD/C02/2020-2021 dated 02.02.2021
(II) SAC/CMG/CPHD/C03/2020-2021 dated 03.02.2021

BRIEF NOTICE INVITING TENDERS

1. On Behalf of the President of India, online item-rate tenders are invited through e-tendering for the following works.

Sl. No.	Title of work	Estimated cost put to tender (Rs)	Period of completion	Period during which the tender document can be downloaded	Last date and time for receipt of tenders	Due date and time of opening of tenders	Earnest money deposit (EMD) (Rs.)
I	Construction of Roads, Side Pathways, Storm Water Drain and External Development works near Auxiliary Building for Infrastructure Facilities under Phase-VII at New Bopal Campus, Ahmedabad.	174.18 Lakhs	06 Months	From 10.02.2021 at 10.00 Hrs. to 22.02.2021 upto 17:00 Hrs.	26.02.2021 upto 17:00 Hrs.	15:00 hrs. on 01.03.2021 (Techno-commercial bid)	NIL, However, EMD Declaration to be submitted in prescribed format.
II	Miscellaneous civil works (Phase-2) in Security Gate complex building at Bopal new SAC campus, Ahmedabad	11.44 Lakhs	02 Months	From 10.02.2021 at 10.00 Hrs. to 22.02.2021 upto 17:00 Hrs.	26.02.2021 upto 17:00 Hrs.	15:00 hrs. on 01.03.2021 (Techno-commercial bid)	NIL, However, EMD Declaration to be submitted in prescribed format.

2. The tender document may be downloaded from e-tendering website www.tenderwizard.com/ISRO during stipulated period by registering with tender wizard and paying tender processing fee. The procedure for vendor registration is displayed on this website. Tender processing fee is payable to M/s. ITI Ltd. through E-gateway.

3. For eligibility criteria and other details, interested tenderers may please refer Detailed Notice Inviting Tender (NTI) on websites www.isro.gov.in or www.sac.gov.in as well as from www.tenderwizard.com/ISRO at tender free view. Tenderers may contact Mr. Sunil Patel (representative from M/s. ITI Ltd) at Mob. No. 9714881992 / 9624981992 in case of difficulty.

Group Director, CMG/SAC

યુનિસેફ અને કારાર કરવામાં આવ્યો

ભારતની સીરમ ઈન્સ્ટીટ્યુટ ૧૦૦ દેશને રસી સપ્લાય કરશે

નવી દિલ્હી, સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) અને યુનિસેફ કોરોનાની રસી કોવિશીલ્ડ અને નોવાવેક્સની લાંબા ગાળાની સપ્લાઈ માટે એક કરાર કર્યો છે. આ કરાર અન્વયે સીરમ ઈન્સ્ટિટ્યુટ વિશ્વના ૧૦૦ દેશમાં ૧.૧ અબજ રસીના ડોઝ સપ્લાઈ કરશે. નોંધનીય છે કે ભારત દુનિયાના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંનું કહેવું એક છે અને ધમા દેશોએ કોરોનાની રસી ખરીદવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. સર્વવિદિત છે કે આઈસકર્ફ-એન્ટીજનેર કોરોનાની રસીનું ઉત્પાદન પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને

નોવાવેક્સનું ઉત્પાદન અમેરિકા સ્થિત નોવાક્સ ઈન્ક દ્વારા કરવામાં આવે છે. યુનિસેફના કાર્યકરી નિર્દેશક હેરરીડા ફોરે સીરમ ખાતે કરાર થયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે પેન અમેરિકન હેલ્થ અિંગ્સના ઈજેશન (વીએચએઓ) સહિતના કેટલાક સંગઠનો સાથે મળીને ૧૦૦ દેશો માટે ૧.૧ અબજ રસીના ડોઝનો ગોદર આપ્યો છે. આ રસી ત્રણ અમેરિકન ડોલરમાં નીચલા વર્ગના અને નીચલા મધ્યમવર્ગના લોકોને આપવામાં આવશે. એક કોવેક્સ પહેલરૂપે ૧૪૫ દેશોના નબળા લોકોને સસ્તા દરે કોરોના રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લગ્નો અને પાર્ટીઓ રદ કરવા આદેશ, નેશનલ કે પછા નહીં મનાવાય

સાઉદી સહિતના અખાતી દેશોમાં કેસો વધતાં શોપિંગ મોલ, જિમ, રેસ્ટોરાં બંધ

દુબઈ, અખાતના આરબ દેશોએ ગુરુવારે ફરી કોરોના વાઈરસનું સંક્રમણ વધવાની ચિંતાને પગલે નવાં નિયંત્રણ લાદ્યા છે. આરબ દેશોની વસતીમાં મોટો હિસ્સો યુવા અને તંદુરસ્ત વિદેશી શ્રમિકોનો હોવાથી અન્ય દેશોની તુલનામાં ત્યાં મૃત્યુદર નીચો રહ્યો છે. જોકે, ન્યૂ યર્ક પછી આરબ દેશોમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાઉદી અરેબિયાએ અમેરિકા સહિત ૨૦ દેશની મુસાફરી પર પ્રતિબંધ મૂકી દેશને આપવામાં આવશે. એક કોવેક્સ પહેલરૂપે ૧૪૫ દેશોના નબળા લોકોને સસ્તા દરે કોરોના રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અરેબિયા દ્વારા તમામ શોપિંગ મોલ્સ, જિમ્સ અને અન્ય લોકેશન્સ તેમજ ઈન્ડોર ડાઈનિંગ ૧૦ દિવસ સુધી બંધ કરી દેવાયું છે. અધિકારીઓએ નવા પગલાં લંબાવાની પણ ચેતવણી આપી છે. સાઉદી અરેબિયાએ દફનવિધી માટે બે કબર વચ્ચે ૧૦૦ મીટર (૩૨૮ ફૂટ)નું અંતર રાખવાનો આદેશ આપ્યાનો છે. સરકારી પ્રેસ એજન્સીએ આરોપ મૂક્યો હતો કે, દેશના કેટલાક પ્રદેશોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ સાવચેતીના પગલાં અને મંજૂર કરાયેલા પ્રોટોકોલ્સના અમલનો અભાવ છે. સાઉદી અરેબિયામાં જન મહિનામાં કોરોનાના કેસમાં ઊછાળો નોંધાયો હતો. જોકે, સરકારના પ્રયાસોને લીધે જાન્યુઆરીની શરૂઆતમાં દૈનિક કેસનો આંકડો ૧૦૦ કરતાં પણ નીચે ગયો હતો.



વિરુપત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિરુપર એપી એમ સી હોલ ખાતે પોકસો કાનૂન શિબિર યોજાય જેમાં વિરુપર પ્રિન્સિપાલ જજ વિજયકુમાર, વિરુપર બાર એસોસિયેશનના પ્રમુખ એલ એન સોલંકી, મામલતદાર હિમાંશુ સોલંકી, વિરુપર પીએસઆઈ વિરુપર કેળવણી મંડળ ના મંત્રી દિલીપભાઈ શુક્લ આચાર્ય કે.બી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત ૧૦૦ થી વધુ બાળકોએ શિબિર મા ભાગ લીધો હતો. (તસ્વીર:- પૂનમ પગી, વિરુપર)

આકાશ ઈન્ફ્રા- પ્રોજેક્ટસ લિમિટેડ
CIN: L45209GJ1999PLC036003
રજી. ઓફિસ: ૨, ગ્રાઉડ ફ્લોર, અભિકેત કોમ્પ્લેક્સ, હોટેલ હવેલીની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧. ફોન નં. : ૦૭૯- ૨૨૨૨૭૦૦૬
ઈમેઇલ:- info@akashinfra.com વેબ સાઇટ:- www.akashinfra.com

નોટિસ
આથી નોટિસ આપવામાં આવે છે કે સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિજલેયર્મેન્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૭ને રેગ્યુલેશન ૨૮ સાથે વાંચતા, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ખાતે શનિવાર, ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ કંપનીના ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ પૂર્ણ થતા ત્રિમાસિક તથા નવ મહિનાના અનઅઉડિટેડ સ્ટેન્ડઅલોન એન્ડ ક્રોસોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપવા તથા અન્ય કાર્યો (જો કોઈ હોય તો) માટે યોજાશે. આ માહિતી કંપનીની વેબસાઇટ www.akashinfra.com ઉપર ઉપલબ્ધ છે.

વતી, આકાશ ઈન્ફ્રા- પ્રોજેક્ટસ લિમિટેડ યોગીનકુમાર પટેલ મેનેજિંગ ડિરેક્ટર
DIN - ૦૦૪૬૩૩૩૫.

તિરૂપતિ સરજન લિમિટેડ
રજિ. ઓફિસ: ૨, એ-૧૧, ૧૨, ૧૩, સચેત્રમે કોમ્પ્લેક્સ, ગુજરાત હાઇકોર્ટની સામે, એસ.જી.હાઇવે, અમદાવાદ. વેબસાઇટ : www.tirupatisarjan.com
CIN: L45100GJ1995PLC024091

નોટીસ
સેબી(લિસ્ટિંગ ઓબ્લિગેશન તથા ડિસ્ક્લોઝર રિજિરેમેન્ડ્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫, (એલઓડીઆર) ના નિયમન ૨૮ની સાથે રેગ્યુલેશન ૪૭ની બેગવાઇઓ મુજબ નોટિસ પાઠવામાં આવે છે કે કંપની દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શનિવાર, ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૧, કંપનીના રજિસ્ટર્ડ ઓફિસ માં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા અનઅઉડિટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવા અને તેને મંજૂરી આપવા માટે શોધવામાં આવી છે. ઉપરોક્ત મિટિંગની વિગતો કંપનીની વેબસાઇટ www.tirupatisarjan.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

તિરૂપતિ સરજન લિમિટેડ
સડિ/ સરજન ટ્રાઇકેશભાઈ પટેલ સંચાલક(DIN-03185133)

MINAXI TEXTILES LIMITED
Regd. Office: Plot No. 3311, G.I.D.C. Phase-IV, Chhatral, Tal.Kalol Chhatral-382729
CIN: L17119GJ1995PLC025007
NOTICE OF BOARD MEETING

Notice, pursuant to Regulation 29 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, is hereby given that a meeting of Board of Directors of the Company will be held on Friday, 12th day of February 2021, at 03.00 P.M. at Registered Office of the Company inter – alia to take note of and approval of the Unaudited Standalone Financial Results of the Company for the quarter ended on 31st December, 2020.

Pursuant to Regulation 47 the said Notice may be accessed on the website of the company www.minaxitextiles.com and may also be accessed on the website of the Stock Exchange on which the shares of the company are listed i.e. www.bseindia.com.

For, MINAXI TEXTILES LIMITED
Dineshkumar P. Patel
(Managing Director)
DIN : 02268757

Place : Chhatral
Date : 04/02/2021

SAKAR HEALTHCARE LIMITED

[CIN: L24231GJ2004PLC043861]

Reg. Office: Block No.10-13, Village: Changodgar, Sarkhej-Bavla Highway, Tal: Sanand, Dist: Ahmedabad – 382 213

Phone: 02717-250477 Fax: 02717-251621 Email: info@sakarhealthcare.com Web: www.sakarhealthcare.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020

PARTICULARS	Rs. In Lakh			
	Quarter ended on 31-12-2020 (Unaudited)	Standalone Nine Months ended on 31-12-2020 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2019 (Unaudited)	Consolidated Quarter ended on 31-12-2020 (Cumulative) (Unaudited)
Total income from operations (Net)	2679.34	7305.79	2226.38	2,679.34
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	224.96	1100.60	292.15	224.96
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	224.96	1100.60	292.15	224.96
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	179.95	894.80	220.96	179.95
Total Comprehensive Income for the period	178.90	891.64	220.96	178.90
Equity Share Capital	1469.10	1496.10	1496.10	1496.10
Earnings Per Share (Face value of Rs. 10/- each) (after extraordinary items) (for continuing and discontinued operations)				
Basic	1.20	5.96	1.48	1.20
Diluted:	1.20	5.96	1.48	1.20

NOTES:

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results (Standalone & Consolidated) filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.

2 The full format of Quarterly Financial Results (Standalone & Consolidated) are available on the website of National Stock Exchange of India Limited at www.nseindia.com

Date : 5th February, 2021
Place : Ahmedabad

For SAKAR HEALTHCARE LIMITED
Sd/- SANJAY S. SHAH
MANAGING DIRECTOR (DIN : 0151296)

કોંગ્રેસને ૧૩૯ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું

કપિલ સિબ્બલે ત્રણ કરોડ, સોનિયા ગાંધી ૫૦ હજારનું યોગદાન આપ્યું

નવીદિલ્હી, કોંગ્રેસને ૨૦૧૯-૨૦ દરમિયાન કેટલું ફંડ મળ્યું તેમની માહિતી સામે આવી છે કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં ૧૩૯ કરોડથી વધુનું ફંડ મળ્યું હતું જ્યારે પાર્ટીના સભ્યોની વાત કરીએ તો વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી કોષમાં સૌથી વધુ ત્રણ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે ચૂંટણી પંચે ૨૦૧૯-૨૦માં કોંગ્રેસને મળેલ ફંડની માહિતી એક રિપોર્ટમાં જાહેર કરી છે.

ચૂંટણી પંચની આ રિપોર્ટ અનુસાર આઈટીસી અને તેની સાથે જોડાયેલ કંપનીઓએ ૧૯ કરોડથી વધુ રકમ ફંડમાં આપી જ્યારે પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ૩૧ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું સંબંધિત કાનુની બીકાનેર દેહાત ભાજપમાં થઈ છે જ્યાં બે વરિષ્ઠ નેતાઓ પર અનુશાસનનો ડંડો ચલાવવામાં આવ્યો છે. એ યાદ રહે કે પાર્ટીએ તાજેતરમાં ભીલવાડામાં પણ નગમ નિગમ ચૂંટણી દરમિયાન પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ ૧૮ નેતાઓને એક સાથે ભરતરફ કરી દીધા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો સતીશ પુનિયાએ બીકાનેર દેહાત ભાજપના રિપોર્ટ પર એકશન લેતા બે વરિષ્ઠ નેતાઓ પ્રીતી શર્મા અને જુગલ કિશોરને પાર્ટીથી છૂટા કર્યાં છે.ભાજપ નેતા પ્રીતી શર્મા પર જ્યાં ભારતના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ નગરપાલિકા ચેરમેનની ચૂંટણી લડવાની ફરિયાદ કરી તો જુગલ કિશોર પાર્ટી વિરુદ્ધ ગતિવિધીઓમાં શંકાસ્પદ ભૂમિકામાં નજરે પડ્યા. પ્રદેશ ભાજપની અનુશાસન

રાજસ્થાનમાં બળવાખોર નેતાઓ વિરુદ્ધ ભાજપની કાર્યવાહી શરૂ

સમિતિની ઈન્છા અનુસાર ડો પુનિયાએ ગત દિવસમાં ભીલવાડામાં પણ ૧૮ બળવાખોર નેતાઓ પર અનુશાસનનો ડંડો ચલાવી શક્યા છે આ નેતાઓ પર પણ ભાજપના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ અપ્રત્ય ઉમેદવારના રૂપમાં ચૂંટણી

લડવાની ફરિયાદો મળી હતી કાર્યવાહી હેઠળ ભાજપ મહિલા મોરચાના પૂર્વ જીલ્લાધ્યક્ષ રેખા પુત્રી અને ચાર પૂર્વ કોર્પોરેટર સહિત ૧૮ કાર્યકર્તાઓને પાર્ટીથી ભરતરફ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આઈએમપી પાવર્સ લિ.

રજી. ઓફિસ : સર્વે નં ૨૬/૩/૨, ગામ સાયલી, ઉમરકોટી રોડ સિલ્વાસ, ૩૮૬૨૩૦ દાદરા અને નગર હવેલી (યુ.ટી.) દેલીકોન નં - ૦૨૬૦૦-૬૫૩૮૫૭૧, ફેક્સ નં - ૦૨૬૦૦-૨૬૧૦૪૩ વેબસાઇટ :- www.imp-powers.com, ઈમેલ : cs@imp-powers.com CIN L31300DN96PLC000232

નોટિસ

સેબીની નિયમન ૪૭ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિજલેયર્મેન્ડ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ નોટિસ દ્વારા રેગ્યુલેશન ૨૮ ની જોગવાઈને ધ્યાનમાં રાખીને નોટિસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શુક્રવાર, ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાશે. કંપનીના કોર્પોરેટ ઓફિસમાં એટલે કે ઉપાધી, બીજી માળ, પાંચમું પ્રેસ બિલ્ડિંગ, પી.ટી. એમ.એમ. માલવીયા રોડ, તારેવ, મુંબઈ-૪૦૦૦૩૪ ખાતેને ધ્યાનમાં લેવા અને મંજૂર કરવા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા થતા ત્રિમાસિક અંત ગણા માટેના અનઅઉડિટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખીને મહાદિન સમીક્ષા લીમીટેડ રિયુ ટીપ્પીટ સાથે. આ નોટિસ કંપનીની વેબસાઇટ www.imp-powers.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

ડો/ડના આદેશ અનુસાર આઈએમપી પાવર્સ લિ. વતી સેડી, આલિયા ઘાટ મેનેજિંગ ડાયરેક્ટર

દેવાદાસ/ જામીનદારોના નામો	ડીમાન્ડ નોટીસ તારીખ અને રકમ	સિક્કોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નું વર્ણન
કી. કરમસીભાઈ દલસંગભાઈ રાઘવી, શ્રીમતી. સમુદ્રેન કરમસીભાઈ દેસાઈ (પ્રોસપેક્ટ નં.૭૪૩૦૭૭)	૦૨-ફેબ્રુ-૨૦૨૧ રૂ. ૩,૯૯,૧૧૨.૦૦/- (રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજાર એકસો એકવીસ પુરા)	યુનિટ નં.૨૦૫ ૧૦૧, શ્રી રંગ નાનો સીટી-૧, હાઉસ ઈપેલ્ટ ઇકોસીટી, સરદારશાહ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૧૦૦ (ભારતની મિલકત અને તેના બધા જ ભાગો સહિત)
શ્રી ભોલેશંકર માસુર, શ્રીમતી. પ્રિતી માસુર (પ્રોસપેક્ટ નં.IL1૯૦૦૨૫૫૪૫)	૦૨-ફેબ્રુ-૨૦૨૧ રૂ. ૧૪,૨૯,૧૭૩/- (રૂપિયા ચૌદ લાખ ઓગણત્રીસ હજાર એકસો તોતેર પુરા)	ઘર નં.૧૨, આશરે ૪૭.૯૬ સ્કે.મીટર, કાશીબા રેસીડેન્સી અને પોસ્ટ સાવલી, સાવલી વડોદરા, ગુજરાત ભારતની મિલકત અને તેના બધા જ ભાગો સહિત
શ્રી. મહેન્દ્ર કુમાર શાંતિલાલ પાઠવીયા, શ્રીમતી. અરૂણાબેન મહેન્દ્ર કુમાર પાઠવીયા, શ્રીમતી. સુશિલા દયાનંદ ગોડસે (પ્રોસપેક્ટ નં.૮૨૬૮૮૪)	૦૨-ફેબ્રુ-૨૦૨૧ રૂ. ૮,૮૬,૧૮૪/- (રૂપિયા આઠ લાખ છતાંસી હજાર એકસો ચોવાંસી પુરા)	ટાવર એફ ફ્લેટ નં.૧૦૩, ૦, શ્રી સિદ્ધીશ્વર હેમીલેસીટી સુચન, એમ.એમ. વોરા શાંત, વડોદરા સોમા તળાવ કોર્સિંગ, કપુરાય, વડોદરા, ૩૬૦૦૨૦ ગુજરાત ભારતની મિલકત અને તેના બધા જ ભાગો સહિત
શ્રી. વિષ્ણુ ગુણવંતરાય પરમાર, શ્રીમતી. જગુભીબેન વિષ્ણુભાઈ પરમાર (પ્રોસપેક્ટ નં.૮૨૧૯૦૨)	૦૨-ફેબ્રુ-૨૦૨૧ રૂ. ૭,૫૯,૮૬૮/- (રૂપિયા સાત લાખ ઓગણસાંઈ હજાર આઠસો અડસઠ પુરા)	ફ્લેટ નં.૧૦૫, પ્લોટ નં.૨૧, શ્રી જયુભીલી કો.ઓપ. હાઉસિંગ સોસા.લી. ભોરતાળાવની પાછળ, ચીખા, ભાવનગર, ૩૬૪૦૦૪, ગુજરાત ભારતની મિલકત અને તેના બધા જ ભાગો સહિત

જો આ દેવાદાર ઉપરોક્ત IIFL, HFL ને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો IIFL, HFL આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત સિદ્ધાંત એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેહાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીની ઓફિસ ધ્રાવ ઓફિસ : અમદાવાદ કોમર્સ હાઉસ, ચોથો માળ, કોમર્સ હાઉસ ૪, શેલ પ્રેડેલર પંપની પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ - ૩૮૦૦૫૧ ૧ અથવા ધ્રાવ ઓફિસ : ૩૦૩, રીજે માળ, ભાવનગર સેક્ટર, સર્કિટ હાઉસની સામે, આર.સી. દત્ત રોડ, વડોદરા, પોન ક્રોડ-૩૮૦૦૦૭ ૧ અને ગ્રાઉડ ફ્લોર, મહેન્દ્ર માર્કેટ, ક્રિકર મોટર ગ્રેડેજ, શકારી હાઈની સામે, વાલ્મીકી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૨ કોર્પોરેટ ઓફિસ : આઈઆઈએનએલ ટાવર, પ્લોટ નં.૮૮, ઉધોગ વિહાર, ફેસ-૪, ટુરુવેલ, હરીયાણા સર્કેટ કર્ગરો.

સ્થાન: અમદાવાદ, વડોદરા, ભાવનગર
તારીખ: ૦૬-૦૨-૨૦૨૧

BISIL PLAST LIMITED

[CIN: L17119GJ1986PLC009009]

Registered Office: 406, Silver Oaks Commercial Complex, Opp. Arun Society, Paldi, Ahmedabad 380 007

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020

(Rs. In lakh)

Particulars	Quarter ended on 31-12-2020 (Unaudited)	9 Months ended on 31-12-2020 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2019 (Unaudited)
Total income from operations (Net)	32.05	86.31	25.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.01	(2.25)	(0.19)
Total Comprehensive Income for the period	0.01	(2.25)	(0.19)
Equity Share Capital	540.31	540.31	540.31
Earnings Per Share (after extraordinary items) (Face value of Re. 1/- each) (for continuing and discontinued operations)	-	-	-
Basic & Diluted:	-	-	-

NOTE.

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.

2 The full format of Quarterly Financial Results is available on the website of BSE Limited at www.bseindia.com

For BISIL PLAST LIMITED
SANJAY S. SHAH
MANAGING DIRECTOR (DIN:01515296)



જયપુર, ભારત અને જાસની સેન્ય વચ્ચેની લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ આઠથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં યોજાશે, એમ સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું. પાકિસ્તાની સરહદની નજીક યોજાવાની આ કવાયતો હેતુ બંને દેશોની સેના વચ્ચે સહકાર વધારવાનો અને યુનાઈટેડ નેશન્સના આદેશ મુજબ આતંકવાદ વિરોધી ઓપરેશન પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે, એમ તેમણે કહ્યું હતું.

જાન્યુઆરીમાં રાજસ્થાનમાં ભારત અને જાસની એરફોર્સ દ્વારા કરાયેલી કવાયત પછી આ દ્વીલ યોજવામાં આવી રહી છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તા લેફ.કર્નલ અમિતાભ શર્માએ જણાવ્યું કે સેન્યથી સેન્ય વચ્ચે એકસયંજ કરવાના કાર્યક્રમના એક ભાગરૂપે

કંપની નોટીસ
પ્રારંભિક નિયામક સમય, ઉપર પશ્ચિમ બેંગ આરઓસી ભવન, રૂબરૂ પાડ સોસાયટીની સામે, અંદર રામ સ્ટોપ પાછળ, નવાપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩
કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ ની બાબતમાં, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩ (૪) અને કંપનીઓ (શાંતિ) નિયમ, ૨૦૧૪ ના નિયમ ૩૦(૧) (એ)

શ્રી શ્રાવન એન્ટરપ્રાઇઝિસ ઓફ માઈટીંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ
CIN : U12200GJ2000PTC037919 ની રજિસ્ટર ઓફિસ : સેક્ટર નંબર એલ-૫૦૩/૪, જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, અંબેલેવર, ગુજરાત - ૩૮૨૦૦૨
.....પિયુષિશર

આથી જાહેર જનતાને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે ઉપરોક્ત અરજદાર કંપનીના સુધિન બદલાવીને યુદ્ધ કરવા માટે કંપનીઓને અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩ હેઠળ કંપનીની રજીસ્ટર ઓફિસ ગુજરાત રાજધાની નેશનલ ફ્રીટાઇઝ ડેવેલપ્મેન્ટ ટ્રસ્ટી લિમિટેડ સાથેના સંબંધોને કારણે કેન્દ્ર સરકારને સમજાવેલ છે અને ના. ૨ ની ડીપ્રેશરના રોજ મળેલ ખાસ અધાપદક સામાન્ય સભ્યમાં કંપનીએ જાણ વિરોધી દાવ્ય પણ કરેલ છે. કોર્પોરેટ યુનિટ જે બેસ કંપનીના નોંધણના ક્ષ